

 **AstroSage**

World's No. 1 Astrology Portal & App



Year Book

Your Personalized 12 Months Horoscope



Table of Contents

Riya Sharma	5
એસ્ટ્રોસેજ વાર્ષિક પુસ્તક માં તમને શું મળશે.	6
આવતા ૧૨ મહિના માટે મહત્વ ના જ્યોતિષીય બિંદુઓ	7
આવતા ૧૨ મહિના માટે સટીક ઉપાયો	8
આવતા ૧૨ મહિના માટે વિશેષ	8
આવતા ૧૨ મહિના માટે વિસ્તૃત વિશ્લેષણ	9
મે 21, 2019 - જુલાઈ 17, 2019	10
આર્થિક જીવન	10
કારકિર્દી	10
શિક્ષણ	10
પારિવારિક જીવન	10
વિવાહિત અને પ્રેમ જીવન	10
આરોગ્ય	10
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	10
જુલાઈ 17, 2019 - સપ્ટેમ્બર 07, 2019	12
આર્થિક જીવન	12
કારકિર્દી	12
શિક્ષણ	12
પારિવારિક જીવન	12
વિવાહિત અને પ્રેમ જીવન	12
આરોગ્ય	12
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	13
સપ્ટેમ્બર 07, 2019 - નવેમ્બર 07, 2019	14
આર્થિક જીવન	14
કારકિર્દી	14
શિક્ષણ	14
પારિવારિક જીવન	14
વિવાહિત અને પ્રેમ જીવન	14
આરોગ્ય	14
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	14
નવેમ્બર 07, 2019 - નવેમ્બર 25, 2019	16

આર્થિક જીવન	16
કારકિર્દી	16
શિક્ષણ	16
પારિવારિક જીવન	16
વિવાહિત અને પ્રેમ જીવન	16
આરોગ્ય	16
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	16
નવેમ્બર 25, 2019 - ડિસેમ્બર 26, 2019	18
આર્થિક જીવન	18
કારકિર્દી	18
શિક્ષણ	18
પારિવારિક જીવન	18
વિવાહિત અને પ્રેમ જીવન	18
આરોગ્ય	18
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	18
ડિસેમ્બર 26, 2019 - જાન્યુઆરી 16, 2020	20
આર્થિક જીવન	20
કારકિર્દી	20
શિક્ષણ	20
પારિવારિક જીવન	20
વિવાહિત અને પ્રેમ જીવન	20
આરોગ્ય	20
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	20
જાન્યુઆરી 16, 2020 - માર્ચ 11, 2020	22
આર્થિક જીવન	22
કારકિર્દી	22
શિક્ષણ	22
પારિવારિક જીવન	22
વિવાહિત અને પ્રેમ જીવન	22
આરોગ્ય	22
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	22
માર્ચ 11, 2020 - એપ્રિલ 29, 2020	24
આર્થિક જીવન	24
કારકિર્દી	24

શિક્ષણ	24
પારિવારિક જીવન	24
વિવાહિત અને પ્રેમ જીવન	24
આરોગ્ય	24
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	25
એપ્રિલ 29, 2020 - જૂન 25, 2020	26
આર્થિક જીવન	26
કારકિર્દી	26
શિક્ષણ	26
પારિવારિક જીવન	26
વિવાહિત અને પ્રેમ જીવન	26
આરોગ્ય	26
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	26
જૂન 25, 2020 - ઓગસ્ટ 16, 2020	28
આર્થિક જીવન	28
કારકિર્દી	28
શિક્ષણ	28
પારિવારિક જીવન	28
વિવાહિત અને પ્રેમ જીવન	28
આરોગ્ય	28
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	29
આવતા ૧૨ મહિનાઓ માં બનવાવાળા વિશેષ યોગો	29
આ અવધિ ની મજબૂતી	30



એક સારા ભવિષ્ય માટે

Riya Sharma

ને સમર્પિત

એસ્ટ્રોસેજ વાર્ષિક પુસ્તક માં તમને શું મળશે.

અમે તમને ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય પસંદ કરવા બદલ આભાર વ્યક્ત કરીએ છે. એસ્ટ્રોસેજ વાર્ષિક પુસ્તક ની મદદ થી અમને યકીન છે કે આવતા ૧૨ મહિના તમારા મુકુટ માં મોરપીંછ લગાડશે. આ માત્ર આશા ની કિરણ નહિ હોય, પરંતુ તમને પોતાની બધી સમસ્યાઓ નું નક્કર પૂર્વાનુમાન અને સરળ સમાધાન પણ આપશે.

એસ્ટ્રોસેજ વાર્ષિક પુસ્તક વૈદિક જ્યોતિષ ના પ્રાચીન સિદ્ધાંતો પર આધારિત છે. યોર ના દૃષ્ટાઓએ, પોતાની ધ્યાનમગ્ન અચેતન અવસ્થા માં, માનવ પીડા ને ઓછી કરવા માટે શોધ કરી અને ખીલવા ની જન્મજાત ક્ષમતા માં મદદ કરી. એજ વિજ્ઞાન નો ઉપયોગ કરી અમે આ વર્ષ ની પુસ્તક બનાવી છે, જેથી તમે પોતાની પુરી ક્ષમતા નો અનુભવ કરી શકો અને એનો ઉપયોગ કરી શકો, અને આવનારા ૧૨ મહિનાઓ માં સફળતા પ્રાપ્ત કરી શકો.

જેમ બ્રહ્માંડીય ઉર્જાઓ નો પ્રવાહ સમય સાથે બદલાયા કરે છે, તમે જોશો કે આવતા ૧૨ મહિનાઓ માં વિભિન્ન અવધિઓ દરમિયાન કઈ સ્થિતિઓ સહાયક અથવા કઠિન-પ્રબળ રહેશે. અને સિવાય તમે કરવા જેવા અને ના કરવા જેવા તથા એવા ખાડાઓ થી બચવાના ઉપાયો જાણશો જે તમારા વિકાસ ને બાધિત કરી શકે છે. અમે લોકો આ દરમિયાન તમારા જન્માક્ષર માં વિભિન્ન રાજ યોગો અને વિશેષ યોગો વિશ્લેષિત કરી ને પ્રસ્તુત કર્યા છે.

તમને આ બધા નું મૂળ આપવા માટે અમે એક અદ્વિતીય સૂચકાંક પણ વિકસિત કર્યો છે જે તમને આવતા ૧૨ મહિનાઓ ની તાકાત દેખાડે છે. બીજા શબ્દો માં કહીએ તો, વધારે તાકાત તમારી ક્ષમતા નો ઉપયોગ કરવા અને વાંછિત પરિણામ મેળવવા માટે સારી સંભાવના છે.

અમે માનીએ છે કે તમે એક અદ્વિત્ય માણસ છો એટલેજ એસ્ટ્રોસેજ વાર્ષિક પુસ્તક તમને ગહનતા થી વિશ્લેષણ, સટીક પૂર્વાનુમાન અને સરળતા થી અનુસરણ ના સુઝાવો આપશે જે વિશેષ રૂપ થી તમારા માટે બનેલા છે. વાર્ષિક પુસ્તક ની મદદ થી તમે તમારા જીવન ચક્ર માં સફળતા ની રાહ પર જશો, જેથી તમને સંતુષ્ટિ ખુશી, સફળતા અને માનસિક શાંતિ મળશે. અમારી સાથે આ અદ્ભુત યાત્રા માં અમે તમારું સ્વાગત કરીએ છે, જે આવનારા ૧૨ મહિનાઓ માં ખુશી અને સમૃદ્ધિ ની યાત્રા છે.

તમારા જન્મ ની વિગતો

જન્મ દિવસ:	7 : 9 : 1982
જન્મ સમય:	7 : 14 : 25
જન્મ સ્થાન:	Firozpur
ટાઈમ ઓન:	5.5
અક્ષાંશ:	30 : 55 : N
દેશાંતર:	74 : 35 : E

આવતા ૧૨ મહિના માટે મહત્વ ના જ્યોતિષીય બિંદુઓ

પક્ષ ના બિંદુઓ

ભાગ્ય અંક:	5
સારા અંક:	2, 7, 9
ભાગ્ય દિવસ:	ગુરુવાર
સારા ગ્રહો:	ગુરુ, સૂર્ય, ચંદ્ર
મિત્ર સૂચકો:	જેમ, સિં, સેજ
સારું લગ્ન:	કેન, લિબ, સેજ, એકવા
ભાગ્ય ધાતુ:	ગોલ્ડ
ભાગ્ય રત્ન:	મૂંગો

વિપક્ષ ના બિંદુઓ

ખરાબ દિવસ:	રવિવાર
ખરાબ કરણ:	ભવ
ખરાબ લગ્ન:	મેષ
શેતાન અંકો:	4, 8
ખરાબ મહિનો:	કાર્તિક
ખરાબ નક્ષત્ર:	મેઘ
ખરાબ પ્રહર:	1
ખરાબ રાશિ:	મેષ
ખરાબ તિથિ:	1, 6, 11
ખરાબ યોગ:	વિષકુંભ
ખરાબ ગ્રહો:	બુધ

આવતા ૧૨ મહિના માટે સટીક ઉપાયો

વૈદિક જ્યોતિષવિદ્યા મુજબ ઉપચારાત્મક પગલાં આપણ ને આપણી સમસ્યાઓ માંથી છુટકારો મેળવવા અને આપણા જીવન માં હકારાત્મક ઊર્જા વધારવા માં મદદ કરે છે. દરેક સમયગાળો અનન્ય તકો અને પડકારો લાવે છે. આ દ્રષ્ટિકોણ થી, આ સમય ગાળો પણ અનન્ય બનશે. અહીં આપેલ ઉપાય તમને 12 મહિના માં મુશ્કેલ પરિસ્થિતિઓ માંથી બચાવશે અને તમારા નસીબ ને વધારવા માં સહાય કરશે. આ ઉપાય ૧૨ મહિના દરમિયાન કરી શકાય છે. તમારા માટે ઉપચારાત્મક ઉપાય છે:

આ મંત્ર નો દરરોજ જાપ કરો: ૐ સામ્બ સદાશિવાય નમઃ

આવતા ૧૨ મહિના માટે વિશેષ

આ સમય ગાળા માં ઘણા ફેરફારો છે - કેટલાક સુખદ બની રહ્યા છે, જ્યારે અન્ય તમારી ઇચ્છાઓ મુજબ હોઈ શકે નહીં. એક બાજુ, તમને આ સમયે ઘણી સિદ્ધિઓ મળશે. બીજી બાજુ, તમને ઘણી વાર ચકાસવા માં આવશે. તેથી, અમે તમારું ધ્યાન અમુક મહત્વપૂર્ણ વસ્તુઓ પર આકર્ષિત કરવા માંગીએ છીએ, જે તમને આ સમયગાળા દરમિયાન શ્રેષ્ઠ બનવા માં અને તમને ખાડાઓ થી બચાવવા માં મદદ કરશે. આ સૂચનો તદ્દન મૂળભૂત હોઈ શકે છે, પરંતુ તેઓ ઊંડા અને લાંબા ગાળા ના અસરો ઉપજાવે છે. ચાલો કેટલાક મહત્વ ના પરિબલો પર ધ્યાન આપીએ કે તમારે ધ્યાન માં શું રાખવું જોઈએ:

કરવા જેવું

- મોટા ભાઈ અને વરિષ્ઠ અધિકારીઓ નું સમ્માન કરો.
- વધારે થી વધારે લોકો જોડે જન સંપર્ક બનાવો.

ના કરવા જેવું

- સંતાન ને અવગણશો નહિ.
- પ્રેમ સંબંધ માં વધારે મહત્વાકાંક્ષા ના રાખશો.

આવતા ૧૨ મહિના માટે વિસ્તૃત વિશ્લેષણ

તમારા જીવન ને અસર કરતી સૂક્ષ્મ શક્તિ હંમેશાં પ્રવાહ માં રહે છે. તેથી, આગામી ૧૨ મહિના નું ઊંડાણપૂર્વક વિશ્લેષણ જીવન ના વિવિધ ક્ષેત્રો માં જુદા જુદા પરિણામો બતાવે છે. હવે, ચાલો આવનારા મહિનાઓ ના વિવિધ ભાગો કેવી રીતે પ્રભાવિત થાય છે તેના આધારે વિગતવાર ભવિષ્ય વાણી જોઈએ:

મે 21, 2019 - જુલાઈ 17, 2019

આર્થિક જીવન

આ સમયગાળા માં અમુક નાણાકીય સમસ્યાઓ હોઈ શકે છે. તેથી દરેક પરિસ્થિતિ નો સામનો કરવા તૈયાર રહો. નબળા આર્થિક બાજુ ને કારણે, તમે કમાણી માં ઘટાડો જોઈ શકો છો. આ સમયે પૈસા ના કિસ્સા માં જોખમો લેવા નું ટાળો, નહીં તો તમારી પાસે નાણાકીય ખોટ હોઈ શકે છે.

કારકિર્દી

આ સમયે તમારા કારકિર્દી માટે તે સરળ રહેશે નહીં, તેથી નોકરી અથવા વ્યવસાય વિશે સાવચેત રહો. આ સમયે વગર જોયે અને ઉતાવળ માં કોઈપણ દસ્તાવેજો પર સહી કરશો નહીં. જો તમે નવું સાહસ શરૂ કરવા માંગો છો, તો સૌ પ્રથમ તેના બધા પાસાઓ પર એક વાર અવલોકન કરો.

શિક્ષણ

તમારે શિક્ષણ માટે આ સમયગાળા માં ક્યાંક જવું પડશે. આ સમયે તમે વધુ મહત્વાકાંક્ષી પણ હોઈ શકો છો, અને તેના કારણે તમે ઓછા પ્રયત્નો માં વધુ સફળતા ની અપેક્ષા રાખો છો પરંતુ તમે કોઈ ચમત્કાર પર આધાર રાખશો નહીં અને ફક્ત તમારા મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરશો, સફળતા તમને ચોક્કસપણે પ્રાપ્ત કરશે.

પારિવારિક જીવન

આ સમયે તમે તમારી કૌટુંબિક જવાબદારીઓ ને પરિપૂર્ણ કરવા માં અસહ્ય અનુભવશો. પરિવારો ની અપેક્ષાઓ તમારા દ્વારા પૂર્ણ થશે નહીં. આ સમયે ઘર માં મનદુઃખ થઈ શકે છે અને આ સમયે માતા પિતા ના સ્વાસ્થ્ય માં પણ ઘટાડો જોઈ શકે છે. બધા તાણ છોડી ને પરિવાર માં સુખ લાવવા નો પ્રયત્ન કરો. પરિવાર થી દૂર જવા ની પણ શક્યતા છે.

વિવાહિત અને પ્રેમ જીવન

આ સમયગાળો વૈવાહિક અને પ્રેમ જીવન બંને માટે થોડું પડકાર રૂપ બનશે. આ સમયે તમારે ધીરજપૂર્વક કામ કરવું જોઈએ અને તમારા સંબંધ ને મજબૂત કરવા માટે જરૂરી પગલાં લેવું જોઈએ. જીવન ભાગીદાર અથવા પ્રિયતમ ને સમજવા ની કોશિશ કરો અને તેમની જરૂરિયાતોને પૂર્ણ કરો.

આરોગ્ય

આ સમયે તમારું આરોગ્ય નબળું રહેશે કોઈક કારણોસર તમારા ખોરાક ની નિયમિતતા પણ અવ્યવસ્થિત હોઈ શકે છે, તેથી તમને સમયસર ખોરાક મેળવવા નું મુશ્કેલ લાગે છે અને તે તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરશે. આ કિસ્સા માં, તમારા આરોગ્ય ની વિશેષ કાળજી લો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- જીવિકા ઉપાર્જન માટે તમારી વાણી નો ઉપયોગ કરો. તમારી તરફ મજબૂત બનો અને પોતાને માન આપો.

શું ન કરો

- વિચારી ને બોલો અને કોઈ ની લાગણીઓ ને નુકસાન ન કરો. લાગણી ઓ પ્રત્યે સંવેદનશીલ રહો અને ભૌતિક વસ્તુઓ ને વધુ મહત્વ આપશો નહીં.

ઉપાય

- સાંજ દરમિયાન સંપૂર્ણ કાળા ઉરદ નો દાન કરો. શ્રી કૃષ્ણ ની ઉપાસના કરો.

આર્થિક જીવન

દસમા ઘર માં બુધ શુભ ફળ પ્રદાન કરે છે, તેથી તમને આ સમયગાળા માં સારો અનુભવ મળશે. નોકરી અને વ્યવસાય માં ઘણી બધી પ્રગતિ અને નફો હશે. તમે તમારા વ્યવસાય ને વિસ્તૃત કરી શકો છો. તમે સંપૂર્ણ કાર્યવાહી અને સમર્પણ સાથે તમારું કાર્ય કરશે. સમાજ ના આદરિત અને માનનીય વરિષ્ઠ લોકો સાથે સંબંધો સુધારવા માં આવશે. આ સમયગાળા માં તમને આ લોકો તરફ થી બધી પ્રકાર ની સહાય મળશે. તમે વાહન નો આનંદ માણશો. આ સમયગાળા માં, તમે આર્થિક રીતે સમૃદ્ધ બનશો અને પરિણામ એ હશે કે તમને ભંડોળ ની કોઈ તંગી નહીં હોય.

કારકિર્દી

તમે સરકારી સહયોગ દ્વારા નાણાં કમાવી શકો છો અથવા તમે સરકાર માં મોટી સ્થિતિ મેળવી શકો છો. તમે વ્યવસાય દ્વારા નફો અને સફળતા બંને કમાશો. તમે વિદેશ થી સારા સમાચાર મેળવી શકો છો. વિદેશ માં વ્યવસાય અથવા નોકરી ની ઓફર વિદેશી આધારિત કંપની પાસે થી મેળવી શકાય છે. આવક સારી રહેશે અને તે વધશે. સમૃદ્ધ હોવા ઉપરાંત, તમે વિવિધ પ્રકાર ની સંપત્તિ કમાશો.

શિક્ષણ

આ સમયગાળા દરમિયાન, તમારું સખત કામ શિક્ષણ ના ક્ષેત્ર માં રંગ લાવશે. તમને જોઈતી પરીક્ષા ના પરિણામો મેળવવા થી મને ખૂબ આનંદ થશે. જો કે, તમારે ટોચ મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. કેટલાક સમય માટે વાંચન અને લેખન પર એકાગ્રતા ની અભાવ હોઈ શકે છે, તેથી તમારું ધ્યાન ભટકશો નહીં. પરીક્ષા માં સારા પ્રદર્શન ને લીધે તમે આદર મેળવી શકો છો.

પારિવારિક જીવન

કોઈ પણ માંગલિક કાર્ય ઘર પર થવી શકે છે. તમે માતાપિતા અને વડીલો નો આદર કરશો અને તેમની આશીર્વાદ તમને વધારશે. આ સમયગાળા માં, તમે જે કાર્ય કરો છો તે ફક્ત શરૂઆત માં જ સફળ થશે. દસમાં ઘર માં બુધ ને કારણે, તમે નિષ્પક્ષ અને નીતિ નિપુણ હશો. અંત:પ્રેરણા તમારા વર્તન માં ધીરજ અને નમ્રતા લાવે છે.

વિવાહિત અને પ્રેમ જીવન

લગ્ન જીવન માં કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે અથવા અભિપ્રાય ના તફાવતો ઊભી થઈ શકે છે, જ્યારે પ્રેમ ના જીવન માટે સમય સામાન્ય રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે વાતચીત કરશો, ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં રહેશે.

આરોગ્ય

આ સમયગાળા દરમિયાન, તમારું આરોગ્ય થોડું ખલેલ પહોંચાડી શકે છે. આંખ અથવા ચામડીની સમસ્યાઓ સાથેની સમસ્યાઓ ની શક્યતા છે, તેથી આ કિસ્સા માં કોઈ બેદરકારી ન લો. જો તમે લાંબી બિમારી થી પીડાતા હો, તો સમયસર ઉપચાર ચાલુ રાખો, નહીંતર બિમારી માં વધારો થવા ની સંભાવના છે.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- કાર્યસ્થળ પર તમારા વિચારો અને કાર્યક્ષમતાઓ નો ઉપયોગ કરો. તમારા ચરિત્ર ને વધારવા માટે પ્રયત્ન કરો.

શું ન કરો

- તમારા કામ માં અપ્રમાણિકતા ન કરો. સ્ત્રી સાથીઓ સાથે સારું વ્યવહાર રાખો.

ઉપાય

- લીલા શાકભાજી દાન કરો. લીલા કપડા કિન્નરો ને ભેટો.

આર્થિક જીવન

આ સમયગાળા દરમિયાન પૈસા લાભ રહેશે, તેમજ સંપત્તિ મેળવવા ની શક્યતા રહેશે. ઘર ના સભ્યો ને આર્થિક ક્ષેત્ર માં લાભ ના યોગ બની રહ્યા છે. ધંધા માં સોદા થી મોટા પૈસા ફાયદા થશે. શુક્ર ની કૃપા થી ભાગ્ય સાથે હશે અને સહેજ પ્રયાસ થી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. જો તમે વિદેશ જવા માંગો છો, તો આ સમયગાળા માં આ મનોરથ પૂરું થઈ શકે છે.

કારકિર્દી

તમે ધંધા અને વ્યવસાય માં સારો કામ કરશો. તમારા મૈત્રીપૂર્ણ સ્વભાવ ના કારણે, તમે તમારા ઘણા લોકો સાથે સંપર્ક માં રહો છો. જો તમે નોકરી કરી રહ્યા હો તો આ સંપર્કો ની સહાય થી તમને નવી નોકરી મળી શકે છે. જો તમે વ્યવસાયિક છો તો તમને આર્થિક ફાયદો થઈ શકે છે. ત્યાં દૂરસ્થ સ્થળો અથવા વિદેશ માં થી સારા સમાચાર મળશે. આ તમને તમારા વ્યવસાય માં સારી સફળતા આપશે.

શિક્ષણ

જો તમે ઉચ્ચ શિક્ષણ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા છો, તો તમે આ સમયગાળા માં સફળતા પ્રાપ્ત કરી શકો છો. શુક્ર ના સાતમા ઘર માં હોવા થી, શિક્ષણ ના ક્ષેત્રે શુભ ફળ મેળવવાની શક્યતા છે. આ સમયે શિક્ષણ અંગે ના તમારા પ્રયત્નો પણ સફળ થશે.

પારિવારિક જીવન

પરિવાર ના સભ્યો વચ્ચે સારી સહજતા મળી આવશે અને ઘર માં સુખ અને શાંતિ નો વાતાવરણ હશે. આ સમયગાળા દરમિયાન તમારા ઘર માં મંગળ કાર્ય પૂર્ણ થવા ની સંભાવના છે. માતા પિતા ઉપરાંત વૃદ્ધ લોકો ની સેવા કરો. કારણ કે તેમના આશીર્વાદ તમને સફળતા ના માર્ગ માં દોરી જશે. આ સમયે ખરાબ કાર્યો અને ખરાબ સંગત થી દૂર રહો.

વિવાહિત અને પ્રેમ જીવન

સાતમા ઘર માં શુક્ર ની સ્થિતિ તમારા લગ્ન જીવન માટે સુખદ રહેશે. આ દરમિયાન, તમારા જીવનસાથી સાથે નો તમારો સંબંધ પ્રગાઢ બનશે અને તમને દરેક પગલે તેમનો સાથ મળશે. તમે તેમની વચ્ચે સારી સહજતા જોશો. તમને તમારા જીવનસાથી સાથે સારી મુસાફરી કરવા ની તક મળશે. તે જ સમયે પ્રેમી યુગલ માટે, આ સમય ખૂબ જ સારો રહેશે.

આરોગ્ય

આ અવધિ માં, તમે શારીરિક અને માનસિક રૂપે ફિટ થશો. આ સમયગાળા દરમિયાન, તમે પોતાની અંદર નવી ઊર્જા અનુભવશો અને દરેક કામ ઉત્સાહપૂર્વક કરશો. તમારા સુધારેલા આરોગ્ય ની અસર તમારા કાર્ય અને પ્રકૃતિ માં જોવા મળશે. પરિણામે, તમને સારા પરિણામો મળશે.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- તમારા જીવનસાથી ને સમર્પિત રહો. જો તમે વ્યવસાય કરો છો તો તેને ગંભીરતા થી લો.

શું ન કરો

- જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વાસનાત્મક વિચારો થી દૂર રહો. અતિરિક્ત ખર્ચ પર પૈસા ખર્ચશો નહીં.

ઉપાય

- શુક્ર બીજ મંત્ર નો જાપ કરો. ઘરે એક સફેદ રંગ ના ફૂલ નો છોડ મૂકો.

આર્થિક જીવન

સૂર્ય, સામાન્ય રીતે સપ્તમ ભાવ માં, મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે, તેથી આ સમય તમારા માટે પડકારો થી ભરપૂર હોઈ શકે છે. ધન હાનિ પણ ઉઠાવી પડી શકે છે. સૂર્યના આ ભાવ માં સ્થિત હોવાને કારણે, તમે કોઈ વાત વિશે ખૂબ ચિંતિત રહી શકો છો.

કારકિર્દી

સફળતા પ્રાપ્ત કરવા માટે, તમારે સખત મહેનત કરવી પડશે, તમને સફળતા મળી જશે પરંતુ કઠિન સંઘર્ષ પછી, તમને તે મળશે. જો તમે ભાગીદારી માં વ્યવસાય કરો છો, તો તમારો ભાગીદાર તમને નુકસાન પહોંચાડી શકે છે તેથી તેમને જરૂરિયાત થી વધારે વિશ્વાસ કરશો નહીં. આ ચિંતા કુટુંબ, નોકરી, વ્યવસાય અથવા શિક્ષણ થી સંબંધિત હોઈ શકે છે. આ સમયગાળા માં તણાવ અથવા તાણને બદલે મનન કરવું અને ધ્યાન કરવું વધુ સારું છે. ત્યાં સરકાર, શાસક પક્ષ અથવા સરકારી વિભાગો તરફથી સમસ્યાઓ હોઈ શકે છે.

શિક્ષણ

જો તમે વિદ્યાર્થી હોવ તો, તમે શિક્ષણ માં ટોચ પર રહેશો. પરીક્ષા માં તમારા સખત મહેનત દ્વારા, તમને સારા પરિણામો મળશે. તમારું આત્મ અને મનોબળ વધવા નું ચાલુ રહેશે, જેના કારણે તમે અભ્યાસ માં સારું પ્રદર્શન કરી શકશો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિ ના યોગ છે. ઉચ્ચ શિક્ષણ માટે કોઈ પણ સારા શૈક્ષણિક સંસ્થા માં પ્રવેશ થયી શકે છે.

પારિવારિક જીવન

સાતમા ભાવ માં સૂર્યની હાજરી તમને જરૂર કરતાં વધુ આત્મ-આદર આપે છે. પરિણામ એ છે કે, લોકો તમને અહંકારી સમજી લેશે, તેથી તમારી અહંકાર નું બલિદાન આપો. જો સંબંધીઓ વચ્ચે કંઈક વિવાદ હોય તો તેને ઉકેલવા માટે પહેલ કરો.

વિવાહિત અને પ્રેમ જીવન

સૂર્ય ની આ ભાવ માં સ્થિતિ વૈવાહિક જીવન માટે યોગ્ય ગણવા માં આવતી નથી, તેથી, જીવન ભાગીદાર સાથે મતભેદ પણ શક્ય છે. આ સમયગાળા માં, વૈવાહિક જીવન માં સંતુલન બનાવી રાખો. વિવાદ અથવા મતભેદ ના કિસ્સા માં સંયમ સાથે કામ કરો અને સંવાદ દ્વારા સમસ્યાઓ ને હલ કરો.

આરોગ્ય

તમને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. તમને તાવ, માથા નો દુખાવો અથવા પિત્ત સંબંધી રોગો નું સામનો કરવો પડી શકે છે. આ સમયે તમારા સ્વાસ્થ્ય ની વિશેષ કાળજી લો. જો સ્વાસ્થ્ય ખરાબ હોય, તો ડૉક્ટર ની સલાહ પ્રમાણે સારવાર લો. આળસ નું બલિદાન કરી શારીરિક શ્રમ પણ કરો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- તમારા જીવનસાથી ને સંપૂર્ણ પણે સ્વીકારો. તમારા વ્યવસાય ભાગીદાર સાથે ઈમાનદારી રાખો.

શું ન કરો

- સ્વયં થી નિમ્ન સ્તર ના વ્યક્તિઓ નું તિરસ્કાર કરશો નહીં. નિરર્થક દલીલો ને વધવા ના દેશો.

ઉપાય

- રવિવારે લાલ કપડાં દાન કરો. પાણી માં લાલ કનેર ના ફૂલ મૂકો અને સ્નાન કરો.

આર્થિક જીવન

તમારી ઇચ્છા અને મહત્વાકાંક્ષાઓ આ સમયગાળા માં પૂર્ણ થશે. તમે મોટા નફા સોદા માં સહભાગી બનશો અને આ તમને સારો નફો આપશે. આ સમયગાળા દરમિયાન લાંબી મુસાફરી ની મજબૂત સંભાવના છે અને આ મુસાફરીઓ ના પરિણામો પણ સારા રહેશે. આ સમયે તમે વિદેશી સફર પર જઈ શકો છો. આ મુસાફરી કામ અથવા ફરવા ના હેતુ થી થઈ શકે છે. આ સમયગાળા માં પૈસા અને મિલકત માં વધારો થશે. કોઈપણ નવા રોકાણો નફાકારક રહેશે અને નવી પ્રોપર્ટી મેળવવા ની તક મળશે

કારકિર્દી

અગિયારમી ભાવ માં સ્થિત ચંદ્ર ની અસર થી, તમે સમાજ માં ગૌરવ મેળવશો. જો તમે સરકારી સેવા માં કાર્યરત છો, તો આ સમયગાળા માં, તમે વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કરશો. જો તમે રાજકારણ માં નસીબ અજમાવી શકો છો, તો તમે આ સમયગાળા માં સફળતા મેળવી શકો છો. આ ઉપરાંત, તમે સરકાર અથવા સરકાર સાથે કામ કરવા ની તક પણ મેળવી શકો છો, અથવા તમે સરકાર પાસે થી માન મેળવી શકો છો. તમે વ્યવસાય દ્વારા ખૂબ લાભ પણ મેળવશો. ચંદ્રના એકાદશ ભાવ માં સ્થિત હોવા થી આ સમયગાળા માં તમારા સ્વભાવ માં ચંચળતા નો વધારો થશે. તમારા મિત્રો અને સહકાર્યકરો તમને મદદ કરશે. અગિયારમા ભાવ માં, ચંદ્ર ની સ્થિતિ તમને સાંસારિક વૈભવ આપશે. પરિણામે, તમને ખર્ચાળ વાહનો નો આનંદ મળશે.

શિક્ષણ

શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરશો. જો કે, કેટલીક વાર મન ચંચળ હોવા થી અભ્યાસ માં રસ નહીં હોય, પરંતુ થોડીવાર પછી મન ફરીથી પુનરાવર્તિત લાગશે અને એકાગ્રતા વધશે. આ સમયગાળા દરમિયાન તમે શિક્ષણ ક્ષેત્રે કેટલીક મોટી સફળતા મેળવી શકો છો.

પારિવારિક જીવન

આ સમયગાળા માં કૌટુંબિક જીવન સામાન્ય રહેશે. જો કે કેટલાક કારણોસર કુટુંબ થી લાંબા સમય સુધી દૂર રહેવા ની જરૂર પડી શકે છે. પરિવાર થી દૂર રહેવા થી, મન ખૂબ જ નિરાશ રહેશે, તેથી આ સમયગાળા માં સંતુલન કરવા ની જરૂર રહેશે.

વિવાહિત અને પ્રેમ જીવન

પ્રેમ જીવન માં પ્રેમ જન્મશે અને તમારા પ્રેમી સાથે ખુશ ક્ષણો નો આનંદ માણશે. વૈવાહિક જીવન માટે સુખી સમય પણ હશે અને તમે તમારા જીવનસાથી સાથે પાર્ટી માં જઈ શકો છો.

આરોગ્ય

આ સમયગાળા દરમિયાન, ચંદ્ર ની અસર થી સારી તંદુરસ્તી રહેશે. કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન નહીં કરે. તે જ સમયે, દીર્ઘકાલીન રોગ માં સ્વાસ્થ્ય લાભ મેળવવા થી મન ખુશ થાય છે અને મન ની શાંતિ અનુભવે છે.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરો, ક્યાંક ફરવા જાઓ કુટુંબ ની જેમ તમારા આસપાસ ના લોકો નો આદર કરો અને તેમને માન આપો.

શું ન કરો

- વ્યવહારુ બનો અને બીજાઓ થી વધારે અપેક્ષા ન રાખો. તમારા વિચારો તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે ભાવનાત્મક રીતે શેર કરશો નહીં.

ઉપાય

- ગળા માં ચાંદી ની ચેન પહેરો. પંચગવ્ય થી સ્નાન કરો.

ડિસેમ્બર 26, 2019 - જાન્યુઆરી 16, 2020

આર્થિક જીવન

મંગળ ની આ સ્થિતિ તમને નાણાકીય ક્ષેત્ર માં ઘણો નિરાશ કરી શકે છે. તે સારું રહેશે કે તમે આ સમયે મોટા આર્થિક નિર્ણયો ના લો અને વિચારશીલ રીતે રોકાણ કરો. જુગાર, સદાબાજી અથવા શેરબજાર માં પૈસા મૂકશો નહીં.

કારકિર્દી

જો તમે ભાગીદારી માં વ્યવસાય કરી રહ્યાં છો, તો ભાગીદાર સાથે નો તમારો સંબંધ વધુ ખરાબ થઈ શકે છે. તમારા રસ્તા માં નવી પડકારો જોઈ શકાય છે. આવી સ્થિતિ માં, ધીરજ ગુમાવશો નહીં અને તે પડકારો નો સામનો હકારાત્મક વિચારસરણી થી કરશો. દુશ્મનો તમારી સમસ્યાઓ માં વધારો કરી શકે છે, તેથી તેમની સાથે સાવચેત રહો અને ચતુરાઈ થી સામનો કરો.

શિક્ષણ

અભ્યાસ માં કેટલાક પડકારો મળી શકે છે. આ સમયગાળા દરમિયાન સફળતા ફક્ત સખત મહેનત દ્વારા પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષા માં ટોચ મેળવવા માટે સખત મહેનત કરવી જરૂરી છે. આ સમયે તમારા શિક્ષકો નો આદર કરો અને તેમના આદેશો નું પાલન કરો.

પારિવારિક જીવન

કૌટુંબિક જીવન માં સંજોગો તમારા વિરુદ્ધ હોઈ શકે છે. ઘર માં મોટા ભાઈ અથવા પિતા સાથે નો સંબંધ કડવો બની શકે છે. સાતમા ઘર માં મંગળ ની હાજરી તમને જરૂર કરતાં વધુ આત્મ-આદર આપે છે. પરિણામ એ છે કે, લોકો તમને અહંકારી સમજી લેશે, તેથી તમારા અહંકાર નું બલિદાન આપો.

વિવાહિત અને પ્રેમ જીવન

સાતમા ઘર માં મંગળ તમારા માટે મુશ્કેલ બની શકે છે. આ સમયે તમારા વૈવાહિક જીવન માં સમસ્યાઓ હોઈ શકે છે. તમને તમારા જીવનસાથી તરફ થી કોઈ પ્રકાર ની સમસ્યા થઈ શકે છે. તેમની સાથે નો તમારો સંબંધ કડવો બની શકે છે. આ ઉપરાંત, બંને વચ્ચે અંતર વધી શકે છે. જો અવિવાહિત હોય, તો મંગળ ની આ સ્થિતિ તમારા લગ્ન માં વિલંબ લાવી શકે છે.

આરોગ્ય

ક્યારેક તમારા મન માં નકારાત્મક વિચારો હોઈ શકે છે. તમારા માનસિક દબાણ માં વધારો થઈ શકે છે, તમારા મન માં એક પ્રકાર નો અસ્વસ્થતા હશે, તેથી આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્ય ની વિશેષ કાળજી લો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- જીવનસાથી ના સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખો. સમાધાન ની કળા શીખો.

શું ન કરો

- જીવનસાથી સાથે વધારે લડશો નહીં. કોઈપણ બાબત ને ઉકેલવા નો પ્રયાસ કરો. દલીલ કરશો નહીં.

ઉપાય

- મોટા કદ ના તવા પર ગોળ ની રોટલી બનાવી ને લોકો ને ખવડાવો. મંગળવારે યોગ્ય જગ્યાએ રક્ત દાન કરો.

આર્થિક જીવન

તમારી મહેનત અને પ્રયાસો આર્થિક બાજુ ને મજબૂત કરશે. તમે કોઈ સરકારી યોજના નો લાભ મેળવી શકો છો. તેમ છતાં તમારા ખર્ચ માં વધારો થવા ની સંભાવના છે, પરંતુ તમે પૈસા બચાવવા માટે પણ સફળ થશો. પિતૃ મિલકત માં વધારો થવા ની સંભાવના છે. શરત લગાડવા નું વલણ અટકાવો.

કારકિર્દી

નિર્ણય લેવા ની ક્ષમતા અને સક્ષમતા ને પ્રતિફળ અસર થઈ શકે છે. તમે તમારી કારકિર્દી વિશે મૂંઝવણ માં રહી શકો છો. ખોટી અપેક્ષાઓ તમારા ધ્યેય ને ભ્રમિત કરી શકે છે. જો તમે લેખન સંબંધિત કામ છો તો આ સમયગાળા દરમિયાન તમને ખૂબ સારા પરિણામો મળી શકે છે.

શિક્ષણ

આ સમયગાળામાં તમારે અભ્યાસ તરફ ધ્યાનમાં મુશ્કેલી અનુભવી શકો છો. મન અભ્યાસ સિવાય અન્યત્ર લાગશે. ગણિત ના વિદ્યાર્થીઓએ આ સમયે સખત મહેનત કરવી પડશે, પરંતુ જો તમે રાજકારણ ના વિદ્યાર્થી હોવ તો તમે આ વિષય માં સફળતા પ્રાપ્ત કરી શકો છો.

પારિવારિક જીવન

તમારે કૌટુંબિક જીવન માં મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે. ઘર માં કોઈપણ પ્રકાર નો ક્લેશ થઈ શકે છે. નાની નાની વસ્તુ ને લીધે ઘર ના લોકો વચ્ચે લડાઈ શક્ય છે. કૌટુંબિક બાબતો વિશે ચિંતા કરવી તમારા માટે દુઃખદાયક હોઈ શકે છે, તેથી આને ટાળો.

વિવાહિત અને પ્રેમ જીવન

વૈવાહિક જીવન માટે આ સમય દુઃખદાયક હોઈ શકે છે. પ્રેમ જીવન માં લોકો ને સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી અથવા પ્રિયતમ સાથે સંબંધો ખાટા પડી શકે છે. આવી પરિસ્થિતિ માં ધીરજ રાખો. જીવન ભાગીદાર ની લાગણીઓ સમજો અને તેમના પર દબાણ ન રાખો.

આરોગ્ય

તમારા સ્વાસ્થ્ય ની કાળજી લો. તમે ફૂડ પોઇઝનીંગ ની ફરિયાદ કરી શકો છો, તેથી તમારા આહાર પર વિશેષ ધ્યાન આપો. આ સમયે બાળકો ના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો. સ્વાસ્થ્ય પર કોઈ પ્રકાર ની બેદરકારી લેવી યોગ્ય નથી. દિનચર્યા માં શારીરિક કસરત ઉમેરો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- તમારા લગ્ન જીવન ને મજબૂત કરવા નો પ્રયત્ન કરો. જીવન માં આવનારી તકો ને સંપૂર્ણ પણે સાર્થક કરો.

શું ન કરો

- તમારા બાળકો પ્રત્યે ફરજ અવગણશો નહીં. દરેક કામ માં કામચલાઉ પ્રયાસ ના કરશો.

ઉપાય

- રાત્રી માં કાળા ઉડદ દાન આપો. કાળા અને વાદળી કપડાં પહેરશો નહીં.

માર્ચ 11, 2020 - એપ્રિલ 29, 2020

આર્થિક જીવન

આ સમયગાળા માં તમને વ્યવસાય માં કેટલાક સુખદ અને ફાયદાકારક ફેરફારો મળશે. તેના પરિણામે તમને પૈસા લાભ મળશે. જો કે, તમારે તમારા પ્રયાસો ને ચાલુ રાખવું પડશે. આ સમયગાળા માં, તમારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા સમાજ માં વધશે. પરિણામે, ઉચ્ચ વર્ગ ના લોકો તમારી સાથે સંપર્ક માં આવશે અને તેઓ તમને લાભ કરશે.

કારકિર્દી

દસમા ઘર માં, ગુરુ તમારા વ્યવસાય માં વધારો કરશે અથવા તમે નોકરી માં આગળ વધશો. આ સંદર્ભ માં, તમારે ઘણી મુસાફરી કરવી પડી શકે છે. વિદેશ માં જવું શક્ય છે. આ સમયે તમે ઉચ્ચ પદ મેળવી શકો છો. સમાજ ના રુઆબદાર લોકો સાથે તમારી મિત્રતા વધશે. તમારી સફળતા કેટલાક લોકો ને ખરાબ લાગી શકે છે, તેથી તમને સાવચેત રહેવા ની જરૂર છે. તે જ સમયે, દુશ્મનો થી પણ સાવધ રહેવા ની જરૂર છે. તેઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર બનાવી શકે છે. જો કોઈ કારણોસર તમારા માર્ગ માં અવરોધ આવે તો વૃદ્ધો નો સંપર્ક કરો.

શિક્ષણ

અભ્યાસ ની બાબત માં મિશ્ર પરિણામો ઉપલબ્ધ થશે. પરિણામ સ્વરૂપે, તમે કેટલીક વખત ભણતર માં ધ્યાન આપશો અને એક સમયે એવો આવશે જ્યારે તમે અધ્યયન કરવા નું પસંદ કરશો નહીં. તેથી આ સમયગાળા માં એકાગ્રતા જાળવવા ની જરૂર રહેશે. તમારા શિક્ષકો નો આદર કરો. તમે આ સમયે ધાર્મિક સાહિત્ય વાંચવા માં રસ લેશો.

પારિવારિક જીવન

કૌટુંબિક જીવન ખુશ રહેશે. સંબંધીઓ વચ્ચે સ્નેહ ની લાગણી જોવા માં આવશે. ભાઈ - બહેનો ને તેમના કાર્યસ્થળ માં પ્રમોશન મળી શકે છે. તેમને પૈસા લાભ ના યોગ છે. તે જ સમયે સમાજ માં તમારા પિતા નો આદર વધશે. આ સમયે માતા સાથે નો તમારો સંબંધ સારો રહેશે. દરેક કાર્ય માં માતા ની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.

વિવાહિત અને પ્રેમ જીવન

જો તમે લગ્ન કર્યા હોય તો ભાગીદાર સાથે નો તમારો સંબંધ મધુર રહેશે. બંને વચ્ચે પ્રેમ વધશે જો કે, આ બાબતે ક્યારેક નાના મુદ્દાઓ પર તકરાર હોઈ શકે છે. તે જ સમયે, તમે કાર્યસ્થળ માં વ્યસ્તતા ને કારણે તમારા જીવનસાથી ને ઓછો સમય આપી શકશો. જો તમારો પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે, તો તમારે થોડા સમય માટે પ્રિયતમ થી દૂર રહેવું પડશે.

આરોગ્ય

તમારું આરોગ્ય જીવન પણ સારું રહેશે. આ સમયગાળા દરમિયાન, આરોગ્ય થી સંબંધિત સમસ્યાઓ થી તમે વિક્ષેપિત થશો નહીં. તમને કોઈ પણ પ્રકાર ના વિકાર નો સામનો કરવો નહીં પડે. જો તમે પહેલે થી જ અસ્વસ્થતા પૂર્વક ચાલતા હો, તો તમને આ સમયગાળા માં આરોગ્ય સુધારણા મળશે.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- તમારા કાર્યક્ષેત્ર માં સહકર્મીઓ માટે શક્ય એટલું મદદ કરો. તમારા કાર્યક્ષેત્ર અને કૌટુંબિક જીવન માં સંતુલન સ્થાપિત કરો.

શું ન કરો

- તમે જે પણ કાર્ય કરો, તે મન થી કરો, તમે બધું જાણો છો એવું દેખાવ. ના કરો. યોગ્ય પ્રસંગો પર સલાહ આપવા નું ચૂકશો નહીં.

ઉપાય

- ગુરુ બૃહસ્પતિ બીજ મંત્ર નો જાપ કરો. ગુરુવારે કેળા ના ફળ દાન આપો.

એપ્રિલ 29, 2020 - જૂન 25, 2020

આર્થિક જીવન

આ સમયગાળા માં, તમારી ઇચ્છાઓ અને મહત્વાકાંક્ષા પૂર્ણ થશે. આ સમયે તમે એક નવું વ્યવસાય શરૂ કરી શકો છો જે આર્થિક ફાયદા માટે એક પ્રબળ સંભવિત હશે. મિત્રો દ્વારા તમને નાણાકીય સહાય મળશે. આ સમયગાળા માં, તમે વેપાર દ્વારા સારા નફા મેળવી શકો છો.

કારકિર્દી

આ સમયગાળા દરમિયાન, તમારો કારકિર્દી બુલંદી ને સ્પર્શ કરી શકે છે કારણ કે આ સમયે તમને તમારા કારકિર્દી માં આગળ વધવાની તક મળશે. તમને નોકરી માં પ્રમોશન મળશે. આ સમયે તમારી મહત્વાકાંક્ષા પણ વધશે અને તમે તેના માટે સખત મહેનત કરશો. જો તમને નિષ્ફળતા મળે તો નિરાશ થશો નહીં.

શિક્ષણ

વિદ્યાર્થીઓ અભ્યાસ માં મુશ્કેલી અનુભવી શકે છે. તમારા મન માં દિશા હિનતા આવશે, જે તમારા એકાગ્રતા ને ઓગાળી શકે છે. કલા અને સાહિત્ય ના વિદ્યાર્થીઓ સામાન્ય પરિણામો મેળવી શકે છે. જો તમે કોઈ વિશેષ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો, તો તમારે સફળતા માટે સખત મહેનત કરવી પડશે.

પારિવારિક જીવન

પરિજનો તમારા માટે વધુ જોડાણ કરશે. કોઈપણ સારા નજીક ના પરિજન બાજુ થી કેટલાક સારા સમાચાર મળી શકે છે. સહકુટુંબ તમે કોઈપણ મુસાફરી પર જાયી શકો છો. તમારા ભાઈઓ અને બહેનો સાથે નો તમારો સંબંધ મધુર રહેશે. સસરા પક્ષ તરફ થી એક સુંદર ભેટ ની આશા છે.

વિવાહિત અને પ્રેમ જીવન

આ સમય વૈવાહિક જીવન માટે સારું રહેશે. તમારા જીવનસાથી અને તમારા વચ્ચે એક સારો તાલ મેલ દેખાશે જીવન ભાગીદાર દ્વારા તમને દરેક પગલા પર સાથ મળશે. તે જ સમયે, પ્રેમ જીવન ની પરિસ્થિતિ તમારા માટે અનુકૂળ હોઈ શકે છે. પ્રેમ ભાગીદાર સાથે સમય પસાર કરવા માટે ઘણી બધી તક હશે.

આરોગ્ય

આ સમયે તમારું આરોગ્ય જીવન સારું રહેશે. જૂની પીડા થી સ્વતંત્રતા મળી શકે છે. શારિરીક રીતે તમે ફિટ પણ દેખાઈ શકો છો. તમારી શક્તિ નો ઉપયોગ આ સમયે યોગ્ય દિશા માં કરો. નશા ન લો અને ડ્રાઇવિંગ દરમિયાન સંપૂર્ણ કાળજી લો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- આગળ વધો અને મિત્રો સાથે સંપર્ક માં રહો અને નવા લોકો સાથે સંપર્ક કરો. તમારી ભૂલો માં થી પાઠ લો અને સમાજ પ્રત્યે તમારી જવાબદારી રાખો.

શું ન કરો

- તમારી ભૂતકાળ અને નિરાશાવાદી વિચાર થી બહાર નીકળો. તમારું કામ ચાલુ રાખો પણ કોઈ અપેક્ષા રાખશો નહીં.

ઉપાય

- શમી ની સમિધા સાથે હવન કરો. વાદળી કપડાં વાપરો.

આર્થિક જીવન

બુધ ના સાતમા ઘર માં રહેવું તમારા માટે સુખદાયક અને કલ્યાણકારી રહેશે. આ સમયગાળા માં, તમારા સન્માન અને પ્રતિષ્ઠા માં વધારો થશે અને તમને સમાજ માં ખ્યાતિ મળશે. આ સમય દરમિયાન તમે પ્રબુદ્ધ લોકો ને મળશો અને તેમની મદદ થી તમને તમારા વ્યવસાયિક જીવન માં લાભ મળશે. વ્યવસાય માં, તમે નફાકારક સોદાઓ કરશો. બુધ ના સાતમા ઘર માં સ્થિત હોવા થી, તમે માત્ર પૈસા જ નહીં, પણ તમારી સૌંદર્ય ની સુંદરતા પણ મેળવશો.

કારકિર્દી

આ સમયગાળા દરમિયાન તમારા વ્યાવસાયિક જીવન માં સારા ફેરફારો થશે. આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયને વિસ્તૃત કરી શકો છો, તેમજ નવી યોજનાઓ લોન્ચ કરી શકો છો. તમારી નોકરીઓ અથવા વ્યવસાય બંને માં થનારી સ્પર્ધા માં માં જીત ની ખાતરી છે. વિરુદ્ધ લિંગ વાળા લોકો દ્વારા સારો ટેકો મળશે. તેઓ દરેક પરિસ્થિતિ માં તમને મદદ કરવા તૈયાર થઈ જશે. આ સમયગાળા દરમિયાન સુખદ મુસાફરી ની શક્યતાઓ પણ છે. આ દરમિયાન, વ્યવસાય ભાગીદારો તમારી સાથે બાજુ પર કામ કરશે. નમ્રતા અને ઉદારતા તમારા સ્વભાવ માં આવશે. આના થી નવા લોકો સાથે તમારી મિત્રતા થશે. જો તમે લેખન અથવા સંપાદન ના ક્ષેત્ર માં છો, તો તમે આ સમયગાળા માં ઘણી સફળતા મેળવી શકો છો.

શિક્ષણ

અભ્યાસ માટે આ સમય સામાન્ય રહેશે. પરીક્ષા માં સફળતા અને સારા ગુણ મેળવવું ફક્ત તમારા મહેનત પર આધાર રાખશે. આ સમયગાળા માં, શિક્ષણ પ્રત્યે નો તમારો મનોબળ વધશે અને સંપૂર્ણ ઇમાનદારી થી કાર્ય કરશે. કેટલાક સમય માટે એકાગ્રતા તૂટી શકે છે, તેથી નિયમિત યોગ તમારા માટે ફાયદાકારક રહેશે.

પારિવારિક જીવન

કુટુંબ માં શાંતિ અને સદ્ભાવ હશે. જીવન સામાન્ય ઝડપે ચાલુ રહેશે. બધા સભ્યો પાસે એક બીજા માટે સન્માન ભાવો હશે. દરેક સભ્ય તમારા સૌમ્ય સ્વભાવ થી ખુશ રહેશે. કોઈ પણ ચોક્કસ પરિસ્થિતિ માં સભ્યો માં મૂંઝવણ હોઈ શકે છે, તેથી સંવાદ દ્વારા તેને દૂર કરવા નો પ્રયાસ કરો.

વિવાહિત અને પ્રેમ જીવન

આ સમયગાળા માં, તમે તમારા જીવનસાથી સાથે મૂંઝવણ અનુભવી શકો છો. તે જ સમયે, જીવનસાથી ના સ્વાસ્થ્ય માં ઘટાડો જોવા મળી શકે છે. પ્રેમ પ્રસંગ ની બાબતો માં, તમારે થોડો સાયવી ને ચાલવું પડશે. મર્યાદિત આચરણ કરો અને તમારા સાથી સાથે કોઈ પણ દબાણ કરશો નહીં.

આરોગ્ય

આ સમયગાળા દરમિયાન, તમારું આરોગ્ય સામાન્ય રહેશે. સુખી રહેવા થી માનસિક તાણ ઓછો થશે. જો તમે લાંબા સમય સુધી કોઈ રોગ થી પીડાતા હો તો આ સમયગાળા દરમિયાન તમને આરોગ્ય લાભો અથવા ની સંભાવના છે. ખોરાક પર વિશેષ ધ્યાન આપો અને દીર્ઘાયુષ્ય માટે સારી

જીવનશૈલી ને અનુસરો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- સમય-સમય પર, તમારા જીવનસાથી ની પ્રશંસા કરો. તમારા કાર્ય માં પ્રમાણિકતા રાખો અને તમારા હેતુ ને સ્પષ્ટ રાખો.

શું ન કરો

- તમારા જીવનસાથી ની ખામીઓ ની ચર્ચા બીજા લોકો જોડે નહીં કરો. નકામી વાદ વિવાદ માં ના પાડો.

ઉપાય

- દરરોજ, શ્રી વિષ્ણુ સહસ્રનામ નું પાઠ કરો, બુધવારે સફેદ ચંદન દાન કરો.

આવતા ૧૨ મહિનાઓ માં બનવાવાળા વિશેષ યોગો

હવે, અમે આ સમય દરમિયાન તમારા જન્માક્ષર માં બનતા કેટલાક ખાસ યોગ અને રાજ યોગ પર એક નજર નાખવા જઈ રહ્યા છીએ. આ યોગો તમારા જીવન માં હકારાત્મક શક્તિ નો પ્રવાહ વધારે છે અને સફળતા અને સમૃદ્ધિ મેળવવા આગળ વધવા માં તમારી સહાય કરે છે. આ સમયે તમે નીચે ના રાજ યોગો ના પ્રભાવ હેઠળ છો:

1.હળ યોગ (હળ)

આ યોગ ની અસર થી આ વર્ષે તમે સારા વાનગીઓ સ્વાદ લો અને તેનો આનંદ માણશો.

2.અનફા યોગ

આ યોગ ની અસર થી આ વર્ષે તમે સારા સ્વાસ્થ્ય અને ધાર્મિક વલણ ના સ્વામી બનશો.

3.પરાશરી રાજ યોગ

આ વર્ષે યોગ ની અસર થી, તમારા જીવનમાં સમૃદ્ધિ હશે.

4.બુધ-આદિત્ય યોગ

આ વર્ષે યોગ અસર થી તમે જાણકાર બનશો અને આદર પામશો.

5.સરસ્વતી યોગ

આ વર્ષે યોગ અસર લખવા માટે તમે જાણકાર અને રસ ધરાવો છો.

6.કહાલાં યોગ

આ વર્ષે આ યોગ ની અસર થી, તમે બહાદુર, નિર્ભીક અને ઉચ્ચ સ્થાને રહેશે.


7.મુસલ યોગ

આ વર્ષે યોગ અસર તમને સ્થાવર મિલકત ના માલિક બનાવશે.

આ અવધિ ની મજબૂતી

જ્યારે જીવન ના વિવિધ પાસાઓ આવે ત્યારે દરેક સમય-સમય અલગ હોય છે. આપણે અત્યાર સુધી આવા ઘણા પાસાઓ વિશે ચર્ચા કરી છે. જ્યારે આપણે આ વિવિધ ઘટકો ને સંપૂર્ણ રૂપે જુએ છે, ત્યારે તે અમને એક વિસ્તૃત છવિ આપે છે અને આ સમય દરમિયાન વધુ સારા નિર્ણયો લેવામાં અમારી સહાય કરે છે. આ પ્રકાર નો પરિપ્રેક્ષ્ય આપણ ને વસ્તુઓ ને ઊંડાણપૂર્વક જોવા માટે સક્ષમ કરે છે અને અમને રેખાઓ વચ્ચે વાંચવા માટે પણ સજ્જ કરે છે. આને પૂર્ણ કરવા માટે, અમે એક અનન્ય અનુક્રમણિકા બનાવી છે જે બધું ધ્યાન માં લે છે અને તમને જણાવે છે કે આ સમય ગાળો કઈ રીતે તમારા માટે ઉત્પાદક અને સફળ રહેશે. ચાલો જોઈએ કે આ અનુક્રમણિકા શું બતાવે છે:

આ અવધિ ની મજબૂતી 80%



અમે આશા રાખીએ છીએ કે આ રિપોર્ટ માં આપવા માં આવેલી માહિતીએ પ્રગતિ ના માર્ગ પર આગળ વધવા માં તમને ઘણી મદદ કરશે અને તમને તમારા સપના અને હેતુઓ ને પ્રાપ્ત કરવા દેશે.



World's No. 1 Astrology Portal & App

વેબસાઈટ	https://www.astrosage.com/
ઇમેઇલ	query@astrosage.com
મોબાઈલ નં.	+91 95606 70006
ટેલિફોન	+91 120 4138503